



ક્રાઈમ મિસ્ટ્રી, ડાન્સ અને ફેશન

આઠઆઠી ગાંધીનગરમાં એન્યુઅલ કલ્ચરલ ફેસ્ટિવલ 'વિથકોન 16'નું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસ ચાલેલા આ ફેસ્ટિવલમાં સોલો સિંગિંગ કમ્પિટિશન, સ્ટ્રીટ પ્લે કમ્પિટિશન, મોક ઇન્ટરવ્યૂ અને મિસ્ટર અને મિસ વિથકોન જેવી ઇવેન્ટ્સ યોજાઈ હતી. સાથે ફેશન શો પનાશ, ક્રાઈમ મિસ્ટ્રી ઇન્વેસ્ટિગેશન ગેમ અને ગ્રૂપ ડાન્સ કમ્પિટિશન પણ યોજાઈ હતી. સ્ટુડન્ટ્સે રવિવારે રાત્રે સનબર્નમાં ઇડીએમ અને ટ્રાન્સ મ્યૂઝિકમાં ડાન્સ કરવાની પણ મજા માણી હતી. આ ઇવેન્ટમાં એનઆઈડી, આઈઆઈએમ-એ, પીડીપીયુ, એનઆઈએફટી, ડીએઆઈઆઈસીટી અને જીએનએલયુના સ્ટુડન્ટ્સે પણ ભાગ લીધો હતો.

